

Corporate Relations Dept. BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai - 400 001.

REF: RCL:KS:BSE-SKSM-INV/25:

Date: 27th August, 2025

Dear Sir / Madam,

Sub: Submission of Newspaper publication released for 100 Days Campaign- "Saksham Niveshak".

Scrip Code: 500360.

With reference to captioned subject, please find enclosed herewith the Newspaper publication for 100 Days Campaign - "Saksham Niveshak" published by the company in newspapers ie "Business Standard" (English Language) and "Loksatta Jansatta" (Gujarati Language) dated 27th August, 2025.

You are requested to take note of the above.

Thanking You,

Yours faithfully,

For RAPICUT CARBIDES LIMITED

Kamlesh M Shinde Company Secretary & Compliance Officer









Navagam KCR Branch: Dharam Empire, Block No. 106/B., Dharam Cinema Compound, Opp. Kamrei B 106/B,, Dharam Cinema Compound, Op Stand, Navagam, Ta. Kamrej, Dist. Surat **Ph.**: (02621) 251835, 252083 **Email:** NKCharRasta.surat@bankofindia

POSSESSION NOTICE [Under Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2002] Whereas. The undersigned being the authorized officer of the Bank of India Navagam KCR whereas, fire unlessing to the during the authorized officer of the Bain of mind a Awagain Rom. Branch Dharam Empire, Block No.106/B, Opp Kamrej Bus Stand, Kamrej Surat-394185, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act No. 54 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dat ped wintries of unle security minetes (chindenien) futures, 2002/SSU25 Calling upon the Borrower Mr. Ramjivan Kapal Mahto Co-Borrower Mr. Ram Sharan Mahto & Mrs. Savitadevi Ramjivan Mahto Guarantor Mr. Anii Mangal Jha to repay the amount mentioned in the notice being Rs.9,53,039.00/-(Rupees Nine Lakh Fifty Three Thousand Thirty Nine Only) as on 28/05/2025 within 60 days from the date of receipt of the said

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower/Guarantor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 22th Day of AUGUST of the

year 2025.
The borrower/ Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of India Navagam KCR Branch, Dharam Enspire, Block No. 106/B, Opp Kamrej Bus Stand, Kamrej Surat-394185, for an amount Rs. 9,53,039.00/- (Rupees Nine Lakh Fifty Three Thousand Thirty Nine Only) as on 28/05/2025 within 60 days from the date of receipt of the said notice with uture interest and incidental charges w.e.f. 28/05/2025

tuture interest and incidental charges w.e.1. 28/05/2025
The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

— DESCRIPTION OF PROPERTY

— All that Pieces and Parcels of Immovable Property at Plot No. 33 area adm 48.00 sq yeards along with undivided proportionate share adm 22.10 sq mts in common road and COP land of society konown as 'Aradhna Lake Town Vibhag-1 situated at Joha, Palsana Surat owned by Mr. Ramjiyah Kapal Mahto, Mr. Ramsharan Kapal Mahto and Mrs. Savitadevi Ramjiyan Mahto together with and

Startaing the combounded as under.				
Boundaries As per document		As per Site		
East :	Adj Society Internal Road	Adj Society Internal Road		
West :	Adj Plot No. 26	Adj Plot No. 26		
North :	Adj Plot No. 32	Adj Plot No. 32		
South :	Adj Plot No. 34	Adj Plot No. 34		

Authorised Officer, Bank of India, Navagam KCR Branch Date :22.08.2025 | Place : Surat



Adajan Branch UG-1, Sanghvi Tower, Adajan Hazira Road, Surat. Ph. 7905867925 Email : adajan@indianbank.co.in

DEMAND NOTICE

Notice under Sec. 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Énforcement of Security Interest Act, 2002

, Mr. Sagarmal Omprakash Sharma (Borrowe/Mortgagor)

2. Mrs. Meera Omprakash Sharma (Co-borrower/Mortigagor)
Add. 1: Plot No. 101/B, Laxminarayan Nagar Society, Near Maharana Pratap Chowk
Godadara, Distt. Surat - 395010.
Add. 2: Plot No. 137, B-Type, "Shree Krishna Valley", B/s Shiv Dhara Residency,
Near Kajriwal Mill, Kareli-Dastan Road, Ta. Palsana, District - Surat - 395010 Dear, Sir/Madam

Sub : Loan account/s Mr. Sagarmal Omprakash Sharma and Mrs. Meera Omprakash Sharma with Indian Bank Adajan branch – Reg.

You committed default in repayment of loans to the tune of Rs. 7.70.562.45 (Rupees Seven Lakhs Seventy Thousand Five Hundred Sixty-Two and Paisa Forty-Five Only) with further interest at the agreed rate from 12/06/2025 till date of repayment. The Bank, issued notice under the Act on 12/06/2025 calling upon you to repay the utstanding amount of Rs. 7,70,562.45 (Rupees Seven Lakhs Seventy Thousand Five Hundred Sixty-Two and Paisa Forty-Five Only) as on 11/06/2025. The notice was sent to you by speed post has been returned unserved.
You are called upon to pay **Rs. 7,70,562.45 (Rupees Seven Lakhs Seventy**

Thousand Five Hundred Sixty-Two and Paisa Forty-Five Only) together with interest from 12/06/2025 till date of payment within 60 days from the date of this notice ailing which Bank, will be constrained to exercise rights of enforcement of security nterest as against the secured assets given in the schedule hereunder. This Notice is without prejudice to any other right / remedy available to the Secured Creditor. "We draw attention to the provisions of Section 13(8) of the SARFAESI Act and the Rules framed there under which deals with your rights of redemption over the

This Notice is without prejudice to any other remedy available to the Secured Creditor including its right to proceed with the proceedings presently pending before DRT/RO of DRT/DRAT/Court and proceed with the execution of order/decree obtained/to be obtained.

SCHED<u>ULE</u>

he specific details of the assets in which security interest is created are enumerated

MORTGAGED ASSETS:

All that piece and parcel of the property bearing B-type of Plot No. 137 (as per plan) adm. 40.18 Sq mtrs. (as per spot adm. 40.17 Sq mtrs.) (as per village form No. 7/12, Block/Survey No. 365/134, adm. 40.18 Sq. mtrs.) with proportionate undivided inchoate share of road and C.O.P. land in Shree Krishna Valley with all appurtenances pertaining thereto, standing on land bearing R.S. No. 349, Block/R.S. No. 365, lying, being & situated at, Village – Kareli, Taluka Palsana, Dist-Surat in the name of Mrs. Meena Omprakash Sharma and Mr. Sagarma Omprakash Sharma, Boundaries : As per sale deed : North : Adi. Plot No. 136. South : Adj Plot No. 138, East : Leaving Behind Plot No. 84, West : Society Road. **Authorised Officer, Chief Manager of Indian Bank**

केनरा बैंक Canara Bank 🕸

STRESSED ASSETS MANAGEMENT BRANCH

Circle Office Building, 8th Floor, 'B' Wing, C-14, G-Block Bandra-Kurla Complex, Bandra East, Mumbai- 400 051 Tel: +91 22 -2269 238782/8744/8771 Email: cb15550@canarabank.com

> FORM B (See rule 7(1))
> FORM OF DEMAND NOTICE

[Under rule 7(1) of the Insolvency and Bankruptcy (Application to Adjudicating Authority for Insolvency Resolution Process of Personal Guarantors to

Corporate Debtors) Rules, 2019)

Mr.Sanjay Permanand Vyas Resi: Pramukh Darshan "B" Lane,Ghatkopar(W),Mumbai-400086. Mr. Mehul Ramesh Gor

Resi: Village ADD C-4,S.T.Colony Pradabhit,Hanuman Road Bhuj,Kutch. Guirat-370001

Mr. Sandeep Ramesh Chandra Vedant Resi: 4/203, Balaji Garden Koperkhairane, Vashi Navi Mumbai-4000709.

Mr. Bharat Chatrabhuj Vedant

Resi:2,Shree Building,R.C.Marg Chembur Mumbai-400074.

Canara Bank, a body corporate constituted under the Banking Companies (Acquisition & Transfer of Undertakings) Act, 1970, having its Head Office at 112, JC Road, Bangalore-560002, and among other places, having its STRESSED ASSET MANAGEMENT BRANCH at Circle Office Building, 8th Floor, 'B' Wing, c-14, G Block, Bandra Kurla Complex, Bandra East Mumbai -400051

Subject: Demand notice in respect of unpaid debt in default due from M/s Ashapura Garments Limited under the Code.

1. This letter is a demand notice of unpaid debt in default due from M/s Ashapura Garments Limited.

2. Please find particulars of the unpaid debt in fault below:

ITICULARS OF DEBT	
ILICULANS OF DEDI	
Total outstanding debt (including any interest or penalties) as on 24.04.2025	Rs. 7,77,69,59,861.24
Amount of debt in default	Rs. 7,77,69,59,861.24
Date when the debt was due	18.02.2015
Date when the default occurred	18.02.2015
Nature of the debt.	Term Loan,DPN & Cash Credit Limit
Secured debt including particulars of security held, the date of its creation, its estimated value as per the creditor (as applicable), and details of securities	Nil
Unsecured debt (as applicable)	Rs. 7,77,69,59,861.24
Details of retention of title arrangements (if any) in respect of goods to which the debt refers	Not Applicable
Particulars of an order of a court, tribunal or arbitral panel adjudicating on the default, if an	Not Applicable
Record of default with the information utility, if any (attach a copy)	-
Details of succession certificate, or probate of a WILL, or letter of administration, or court decree (as may) be applicable), under the Indian Succession Act, 1925 (10 of 1925) (attach a copy)	Not Applicable
Provision of law, contract or other document under which debt has become due	Guarantee Agreement executed in the capacity of Personal Guarantee
A statement of bank account where deposits are made or credits received normally by the creditor in respect of the debt of the corporate debtor, from the date on which the debt was incurred	Attached
List of documents attached to this notice in order	Statement of accounts
	Total outstanding debt (including any interest or penalties) as on 24.04.2025 Amount of debt in default Date when the debt was due Date when the debt was due Date when the debt. Secured debt including particulars of security held, the date of its creation, its estimated value as per the creditor (as applicable), and details of securities Unsecured debt (as applicable) Details of retention of title arrangements (if any) in respect of goods to which the debt refers Particulars of an order of a court, tribunal or arbitral panel adjudicating on the default, if an Record of default with the information utility, if any (attach a copy) Details of succession certificate, or probate of a WILL, or letter of administration, or court decree (as may) be applicable), under the Indian Succession Act, 1925 (10 of 1925) (attach a copy) Provision of law, contract or other document under which debt has become due

3. If you believe that the debt has been repaid before the receipt of this notice. please demonstrate such repayment by sending to us, within fourteen days of receipt

to prove the existence of debt and the amount in

(a) an attested copy of the record of electronic transfer of the unpaid amount from the bank account of the guarantor; or (b) evidence of encashment of cheque for the unpaid amount issued by the guarantor;

(c) an attested copy of any record that Canara Bank has received the payment.

4. The undersigned request you to unconditionally pay the unpaid debt in default in full within fourteen days from the receipt of this letter failing which insolvency resolution process, under the Code, shall be initiated against you

Chief Manager

Circle Office, 7th Floor, Gift One Building Gift City, Gandhinagar-382355 🕎 सिंडिकेट Syndicate

This is in reference to the e-auction sale notice published in The Business Standard Newspapers dated 26.08.2025, which is scheduled to be held on 11.09.2025, it is clarified that. Sr. No. 4, in the property of Rameshbhai Popatbhai Ladva, kindly read the reserve price Rs. 4,40,000/- instead of 4,50,000/- and EMD Rs. 44,000/- instead of 45,000/-. Sr. No. 20 & 21, in both the property of M/s ST Impex, kindly read the reserve price Rs. 44,50,000/- instead of 45,00,000/- and EMD Rs. 4,45,000/- instead of 4,50,000. Sr. No. 22, in the property of Aliz Akbar Calcuttawala, kindly read the reserve price Rs. 4,04,000/- instead of 4,05,000/- and EMD Rs. 40,400/- instead of 40,500. Sr. No. 23, in the property of Shivnath Baburam Prajapati, kindly read the reserve price Rs. 5,00,000/- instead of 5,30,000/- and EMD Rs. 50,000/- instead of 53,000/-. All other details of the E-auction will remain the same.

Place : Gandhinagar Auhorised Officer, Canara Bank

Public Notice for Destruction of Medical Records

The Medical Audit Committee of "Sterling Cancer Hospital" Ahmedabad has decided to destroy the Medical Records of those Indoor Patients, OPD, and Radiation, Chemotherapy & PET Scan (Except Births, Deaths and Medico Legal Cases) who were admitted during the time period of 1st January, 2018 to 31st

Patients, Relatives, and Clinicians who want to retrieve their Medical Records contact the "Medical Administration" of Sterling Cancer Hospital, Sindhu Bhavan, Ahmedabad, within one month from the day of this advertisement.

For the process of retrieval, one must contact citing the IP No (In Patient Number), full name of the patient, along with proof of

Please contact on the Email ID: medicaladmin.ahd@sterlinghospitals.com

Please note that no request for the above patient case files

STERLING HOSPITALS SINDHIL RHAVAN a unit of "Sterling Addlife India Pvt. Ltd." CIN # U85110GJ2000PTC039121 **Regd. Off.:** Sterling Hospital Road, Memnagar Ahmedabad-52. Tel: 079-4001 1111



पंजाब नेंशनल बैंक 🐸 punjab national bank **U** pnb ARMB, 3rd Floor, Near Bijali Ghar, Lal Darwaja, Ahmedabad - 380001, Email: cs4517@pnb.co.in

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorised Officer of the Punjab National Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 18.06.2025 calling upon the Borrowers/Guarantors/ Mortgagors Mr. Suiitkumar Kanii Chunara to repay the amount mentioned in the notice Being Rs. 6.04.981.43 (Rupees Six Lakhs Four Thousand Nine Hundred Eighty One and Paisa Forty Three Only) as on 31.05.2025, payable with further interest and expenses until payment in full, within 60 days from the date of notice / date of receipt of the said notice.

The Borrowers/Guarantors/Mortgagors having failed to repay the amount notice is hereby given to the Borrowers/Guarantors/Mortgagors and the public in general that the undersigned has taken Possession of the property described nerein below in exercise of powers conferred on me under Section 13(4) of the said Act read with rule 8 of the said rules on this 22.08.2025.

Section 13 of the Act in Respect of time Available to Redeem the Secured

hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the PUNJAB NATIONAL BANK for an amount of Rs. 6,04,981.43 (Rupees Six Lakhs Four Thousand Nine Hundred Eighty One and Paisa Forty Three Only) as on 31.05.2025 with payable further interest and costs thereon until payments/realization in full.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Flat No. 508, 5th Floor, Block No. 1, Shivalay Apartment, LIG-14, New Textile Mile Compound Resides Sumel Business Park-3 Hirabha 17 + 18 + 20Market Road, Sarangpur, Ahmedabad - 380002, Bounded by: Avas (AMC Plot)

Dt.: 22.08.2025 | Place: Ahmedabad Sd/- Authorised Officer, Punjab National Bank



Ahmedabad,PIN-380006 अहमदाबाद, गुजरात

FORM NO. 14 [See Regulation 33(2)]					
RP / RC No.	19/2012	OA No.	3A/2007		
BANK OF BARO	DA	Certificate Hol	der Bank		

Certificate Debtors M/s Metro Electric Engineering Co.

C.D.No.1: M/s Metro Electric Engineering Co., Mangalam Mangalam Complex, 40, Punit Nagar, Nr. Vidyut Nagar, Old Padra Road, Vadodara

C.D.No.2: Mr. Harshad Maganlal Shukla

C.D.No.6:M/s Maintenance Corporation, (2 to 7 at1, Heritage Bunglow, Vasna Road Octroi Naka, Vadodara)

C.D.No.7: Ms Swatiben Harshad Shukla, (2 to 7 at 1, HeritageBunglow, Vasna Road Octroi Naka, Vadodara)

C.D.No.8: Shree Maintenance Contract Pvt. Ltd.

40, Punit Nagar, Nr. Vidyut Nagar, Old Padra Road, Vadodara) In view of the Recovery Certificate issued in O.A.No.3A/2007 passed by the Hon'ble Presiding Officer, Debt's Recovery Tribunal-II, Ahmedabad, an amount of

Rs.36,80,950.61 (Rupees Thirty Six Lakh Eighty Thousand Nine Hundred Fifty an Sixty One paise Only) including interest as on 25/06/2007 and further interest from 26/06/2007 plus cost due against you (Less Recovery, if any).

the notice, failing which the recovery shall be made as per rules. In additions to the sum aforesaid you will be liable to pay:

(a)Such interest and cost as in payable in terms of Recovery Certificate.
(b)All costs, charges and expenses incurred in respect of the service of this notice and other process that may be taken for recovering the amount due Given under my hand and the seal of the Tribunal, this day 23/07/2025.

Next date 17/10/2025



Sd/ (Anubha Dubey) RECOVERY OFFICER-I Debts Recovery Tribunal-II, Ahmedabad

GOVERNMENT OF TAMILINADU WATER RESOURCES DEPARTMENT AMARAVATHI BASIN CIRCLE, PALANI-624601.

LUMPSUM CONTRACT (TWO COVER SYSTEM) e-Tender Notice, NIT.No: 5 SE/ Amaravathi Basin Circle, Palani/2025- 2026/ Dt:26.08.2025 For and on behalf of the Governor of Tamil Nadu, e-tenders are invited from the Registered Contractors of WRD / PWD for th Sollowing works by the undersigned up to 15.00 Hrs. on 03.10.2025 Prequalification applications alone will be opened at the below

ı	men	nentioned time and date.							
	SI No	Name of work	EMD Rs	Period of Completion (Including rainy season)	Date and time of tender opening (as per server clock				
		Widening the Pappankulam supply channel to divert the surplus Flood Water of Varadhamanathi Dam in Palani Taluk of Dindigul District to Non-system tanks of Nallathangal odai and Nallathangal Reservoir in Oddanchathiram Taluk of Dindigul District. Approximate Value of work Including 18% GST Rs.5730.00 Lakhs	28,75,000	18 Months	03.10.2025 at 15.30 Hrs.				

ittp://www.tntenders.gov.in to enable the tenderers to view and download the e-tender document through online at free cost and submission of tenders shall be done only through online. Superintending Engineer, WRD., Amaravathi Basin Circle, Palan DIPR/4649/TENDER/2025

Piccadily Agro Industries Limited CIN: L0115HR1994PLC032244

Regd Office:- Village Bhadson Umri- Indri Road, Tehsil Indri, Distt. Karnall, Haryana - 132117. Email ID: <u>piccadilygroup34@rediffmail.com</u> Notice is hereby given that following share certificates issued by the Company are stated to be lost / misplaced and the registered holders thereof have applied to the Company for issue of duplicate share certificates.

olio No	Name of the shareholder	Share Certificate No	Distinctive Numbers		No of Share
	Silaitiolati	NO			
			From	То	
013256	K S SANTANI	00132330 - 00132333	023126221	023126620	400
013256	K S SANTANI	00154805	026161971	026162370	400
013256	K S SANTANI	00161481	051536541	051537340	800
ho Bubli	o io horoby wor	ned against purchasin	a or doaling	in any way	with the above

The Public is nereby warned against purchasing or dealing in any way with the above share certificates. Any person(s) who has/have any claim(s) with Company in respect or the said share certificates should lodge such claims at its registered at the address given above within 15 days of the publication of this notice after which no claim will be entertained and the Company will proceed with issuance of duplicate Share Certificates. Place : Haryana Date : 25/08/2028 For Piccadily Agro Industries Limited Company Secretary

Div **Dudhsagar Dairy** India's Largest Co-operative Dairy Mehsana District Co-operative Milk Producers' Union Ltd Post Box No.1, Highway, Mehsana-384002 Phone.:02762-253201 Website: http://www.dudhsagardairy.coop/tenders/ F-Tender Notice

nder ID

Work Description Civil work & Internal electrification work for ET. Laboratory at CFP 10/09/202 213624 Re-tender: Comprehensive Maintenance Contract (CMC) for Freezers and Visi Coolers at Amul Milk Booths in Delhi NCR. 10/09/202 Supply of cleaning chemical for silo and lines CIP at Milk chilling centres of Dudhsagar National Network. 10/09/20 10/09/2025 218153 Supply of spares for screw compressor at Kadi 218194 Supply of battery for UHT UPS at Manesar. 10/09/2025 10/09/2025 16514 Annual rate contract for Thermal Paper Roll at Dharuhera. 10/09/2025 16107 Annual rate contract for Dry Fruit Cashew Nut at Dharuhera. Annual Maintenance Contract of PMA for Rockwell parts yoghu Annual Maintenance Contract of Manual Maintenance Contract of Manual Maintenance Contract of Manual 10/09/202 16235 ARC for Civil Painting Work at Dharuhera and Manesar. 10/09/202 218164 Supply of Fristam make Pumps at Mehsana. 10/09/202 218244 Supply & Installation of Induced draft Counter Flow Cooling Towers at Mehsana. 10/09/202

E-Tender Website: https://tender.nprocure.com/ For details refer tender document available on e-tender website.We regularly publi our RFQ's on website: https://dudhsagar.nprocure.com/

Date: 27/08/2025 I/C Managing Directo

PUBLIC NOTICE

I, Adv. KIRITSINH C. SOLANKI, on behalf of my client this Public Notice is nereby given to the public at large that the residential property more particularly mentioned in Schedule-A is owned and purchased by D.L.Singh (Dhaneshwar lal Singh Mahadev Singh) under Regi. Sale Deed dated: 04-. 05-1979, registered as Document No.: 340/1979 at the office of Sub-Registrar Ankleshwar, Dist.: Bharuch & Amended Regi. Deed is executed and registered on dated: 12-12-1979, Registered as Document No. 1315/1979 at the office of Sub Registrar-Ankleshwar, Dist.: Bharuch, The Original Sale Deed No.: 340 dated 04-05-1979 & Amended Regi.Deed No.: 1315/1979, dated 12-12-1979 and it's Original Registration Fee Receipt were lost/misplaced.

Hence, any person(s) having any claim or otherwise however of whatsoever nature in respect of the above mentioned documents shall intimate the undersigned writing within SEVEN DAYS from the date of this publication, failing which any objection raised thereafter will not be entertained and shall be considered as waived. Additionally, if at any in time the Original Documents is found and produced by any person(s) before any authority, the same shall be considered as invalid. **SCHEDULE-A**

All that piece and parcels of Immovable property being a residential Plot No.:5 Ad.: 181.05 Sq.Mtr "The Vaishali Co.Op.Housing So.Ltd." situated within the limit of Nagar Palika Ankleshwar,Dist.:Bharuch, bearing R.S. No.: 546, City Survey No.: 3539

Date: 26-08-2025 Place: Ankleshwar

Office: F-15.Uma Complex. Civil Court Road, Opp. Yes Bank, GIDC.Ankleshwar Mb. 9427131752

receipt of the said notice

KIRITSINH C. SOLANKI (Advocate)

On behalf of and Under the

Instruction of my Client

APPENDIX IV [See Rule 8 (1)] POSSESSION NOTICE (For Immovable Property) Whereas, The undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(12) read with (Rule-8) the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 03-10-2024 calling upon the Borrowers/Guarantor/ Mortgagor Mr. Santram Ramdev Banaiah and Mrs. Gitaben Santram Baniya to repay the amount mentioned in the notice being Rs. 16,85,341.97 (Rupees Sixteen Lakh Eighty Five Thousand Three Hundred Forty One and Paisa Ninety Seven Only) as on 03-10-2024 with further interest and expenses within 60 days from the date of notice/date of

वैंक आंग्रा बड़ोदा Bank of Baroda Vadodara-390019. M: 9909023083

The Borrowers/Guarantor/Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 24th day of August of the year 2025

The Borrowers/Guarantor/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda, Khodiyar Branch for an amount of Rs. 16,85,341.97 (Rupees Sixteen Lakh Eighty Five Thousand Three Hundred Forty One and Paisa Ninety Seven Only) as on 03-10-2024 and interest plus other charges thereon.

The borrower's attention is invited to provision of sub section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

Description Of Immovable Property

All that piece & parcel of the immovable residential property being R.S. No. 421 Paikki, Total admeasuring 1312 Sq. Mtrs. Known as "JAGANNATH FLAT" Paikki First Floor , Flat No. 112 built up construction admeasuring 47.58 Sq. Mtrs. Undivided share of land admeasuring 29.41 Sq. Mtrs. of Moje Danteshwar at Registration District and Sub - District Vadodara belonging to Mrs. Gitaben Santram Baniya & Mr. Santram Ramdev Banaiah and bounded as: East: - By Flat No. 111, West: - By Margin Space, North: - By Margin Space, South: - By Flat No. 101.

Date: 24.08.2025 Place: Vadodara **Authorised Officer** Bank of Baroda

Rapicut Carbides Limited

Regd. office: 119, GIDC Industrial Area, Ankleshwar - 393002 Gujarat Email: investors@rapicutcarbides.com Website: www.rapicutcarbides.com

NOTICE TO SHAREHOLDERS

Subject: Launch of "Saksham Niveshak" Campaign - Action Required for Unclaimed Dividends and KYC Updates

Pursuant to Investor Education and Protection Authority (IEPFA), Ministry of Corporate Affairs (MCA) letter dated 16th July 2025, Rapicut Carbides Limited are pleased to inform you of the commencement of a 100-day special outreach initiative titled "Saksham Niveshak", starting from 28th July 2025 to

6th November 2025. This campaign is being undertaken to facilitate shareholders in updating Know Your Customer (KYC) details including:

- Bank account mandates
- Nominee registration

Last Date

Contact information (email, mobile number, address)

This campaign is also being undertaken to facilitate the shareholders to claim. their Unpaid / Unclaimed Dividends for any financial year in order to prevent their dividend amount and shares being transferred to IEPFA

Action Required Shareholders who have not claimed their dividends or have incomplete KYC records are requested to contact the Company's Registrar and Transfer

Agent (RTA) at the earliest: MUFG Intime India Private Limited, C-101, Embassy 247, L.B.S. Marg Vikhroli (West), Mumbai - 400083 Phone: 8108116767 https://web.in.mpms.mufg.com/helpdesk/Service_Request.html.

Additionally, shareholders are encouraged to register and track their requests

through the SWAYAM portal: https://swayam.in.mpms.mufg.com Important Advisory Please note that as per applicable provisions, if dividends remain unclaimed for a period of seven consecutive years, the dividend amounts, and corresponding base shares (if available) are liable to be transferred to the

Investor Education and Protection Fund Authority (IEPFA). We urge all shareholders to take prompt action during the campaign period to safeguard their entitlements and ensure compliance with statutory requirements

For Rapicut Carbides Limited Date: 26th August, 2025 Abhishek V. Gami Place: Ankleshwar Managing Director (DIN:07570948

्री बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

Nanpura Branch: 849/1-8, J.T. Chambers, Athugar Street, Nanpura, Surat – 395001, **Phone** - 0261-2473113, 2471994 2462341, **Email**-nanpur@bankofbaroda.com ANNEXURE C NOTICE TO BORROWER

(UNDER SUB-SECTION (2) OF SECTION 13 OF THE SARFAESI ACT, 2002) MRS RINKI RAJESHKUMAR KORI(Borrower)

MR RAJSHEKHAR CHHOTELAL KÖRI (Co-Borrower) 146/B Shivam Residency Vibhag-1 Near Rashi Residency Kareli Palsana Surat-395023

Sub.: Notice under section 13(2) of the Securitization and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act, 2002, hereinafter called "The Act" Mrs Rink Rajeshkumar Kori (Borrower) and Mr Rajshekhar Chhotelal Kori (Co-Borrower)

.We refer to sanction letter no. No.Ref : Adv/ Retail -00000184274-LMS dt 16.11.2019 conveying sanction of Term Loan facility and the terms of sanction. Pursuant to the above sanction, you have availed and started utilizing the credit facilities after providing security for the same, as hereinafter stated. The present outstanding in various loan/credit facility accounts and the security interests created for such liability are as under: Rates of 0/s as on 06.08.2025 Description Of Securities (please Mention

Nature & type of Facility	Limit	Interest at Present	(inclusive of interest up-to 31.07.2025)	The Details Of Security Agreements And Details Of Mortgaged Property Including Total Area And Boundaries)	
Home Loan (218506000 14557)	Rs. 8.7	8.40% (BRLLR 8.1% +Risk Premium 0.05% + Credit Spread 0.25% (Floating rate)	Rs. 8,26,566.10 /- (Principal) + Rs.18,480.51/- (Unrealized Interest + Unapplied interest) = Rs. 6431.51 /- Further Interest thereon + and Other Charges if any	bearing block no 128 revenu survey no 128/129/133 of village kareli Sub district Palsana Distri Surat on the name of Mrs Rin Rajeshkumar Kori(Borrower) an Mr Rajshekhar Chhotelal Kori (C borrower) having boundaries: East: Plot no 153, West: Sociel Road, North: Plot No 147, South	
Total	8.7		Rs.8,51,478.12 /- Further Interest	East: Plot no 153, West: Society Road, North: Plot No 147, South:	
			thereon +and Other Charges if any	FIGURE 149.	

			thereon +ar Charges if a		ot no 149.	
Sr. No	Brief Desc	ription of proper	tv i	Security Agreeme	nt Area	Boundaries
1.	bearing plot no 44.61 sq mtra proportionate sh	and parcels of the 148/B admeasures together with are in road and ope ENCY VIBHAG-1" s	ring about undivided en land at "	mortgage	Admeasuring 44.61 Sq. mtrs.	North: Plot No 147 South: Plot no 149 East:

Plot no 153

the land bearing block no 128 revenue survey no 128/129/133 of village -kareli Sub district

Palsana District Surat.

In the Term Loan agreement dated 28.11.2019 you have acknowledged your liability to bank to the tune of Rs 8,70,000/-. The outstanding's started above include further drawings and interest up to 26.07.2025 in Term Loan account. 3. As you are aware, you have committed defaults in payment of interest on above loans/outstanding's for the quarter to be ended June 2025. You have also defaulted in payment of installments/ interest of Term Loan which have fallen due for payment on 25.04.2025 and thereafter. **4.** Consequent upon the defaults committed by you, your loan account has been classified as non-performing asse on 24.07.2025 in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest thereon. 5. Having regard to your inability to meet your liabilities in respect of the credit facilities duly secured by various securities mentioned in para 1 above, and classification of your account as a non-performing asset, we hereby give you notice unde sub-section (2) of section 13 of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank Rs. Rs.8.51.478.12 /- (Rs.Eight Lacs Fifty One Thousand Four Hundred Seventy Eight and Twelve rupees only) + Interest and Other Charges thereon in Term Loan account as stated in para 1 above and further uncharged interest from **25.04.2025** and other charges in in Term Loan account, within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amoun with interest till the date of payment, we shall be free to exercise all or any of the rights unde sub-section (4) of section 13 of the said Act, which you may please note. 6. Please note that nterest will continue to accrue at the rates specified in para 1 above for each credit facility until payment in full. 7. We invite your attention to sub-section 13 of section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written consent. We may add that non-compliance with the above provision contained in section 13 (13) of the said Act, is an offence punishable under section 29 of the Act. 8. We further invite your attention to sub section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, it the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of notice for public auction/ inviting quotations/ tender/ private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available

Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, the right to make further demands in respect of sums owing to us.

Date : 06 08 2025 | Place : Surat Authorized Officer, Bank of Baroda, Nanpura Branch

Regional Office: ICICI Bank Limited, Jayhind Annex, Opp. Sharda Baug, Near Dharam Cinema, Rajkot- 360001.

PUBLIC NOTICE-TENDER CUM E-AUCTION FOR SALE OF SECURED ASSET [See proviso to rule 8(6)] Notice for sale of immovable assets

E-Auction Sale Notice for the sale of immovable asset(s) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. This notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/ charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Limited will be sold on 'As is where is', 'As is what is' and 'Whatever there is' as per the brief particulars given hereunder;

Sr. No.	Borrower(s)/ Co-Borrowers/ Guarantors/ Loan Account No.	Details of the Secured asset(s) with known encumbrances, if any	Amount Outstanding	Reserve Price Earnest Money Deposit	Date and Time of Property Inspection	Date & Time of E-Auction
(A)		(C)	(D)	(E)	(F)	(G)
1.	Vatshalbhai Mahendrabhai Dave (Borrower)/ Priya	Sub Plot No. 5, Vivekanandnagar, Street No. 15, Near Rangila Hanuman, Revenue Survey No. 259 Paiki, Plot No. 47, C.T. Survey Ward No.	Rs. 37,39,067/- (As on	Rs. 21,00, 000/-	September 04, 2025 11:00 AM	September 17, 2025 From
	Vatshalbhai Dáve (Co- Borrower) Loan A/c No. LBRAJ00006207108/ LBRAJ00006412520	11/2, T.P. Scheme No. 6, Final Plot No. 123 Paiki, Kothariya Road, Rajkot, Gujarat- 360002. Admeasuring Land Area 69.68 Sq. MtrFree Hold Property	August 21, 2025)	Rs. 2,10, 000/ -	To 12:00 Noon	11:00 AM Onwards
2.	Bakaraniya Prajesh Dilipbhai (Borrower)/ Bakaraniya Dilipbhai	Flat No. C-303, 3rd Floor, Wing-C, Iscon Heights, Opposite Adinath Mahadev Temple, Near Sthaptya Planet, Revenue Survey No. 349	Rs. 32,62,147/- (As on	Rs. 26,50, 000/-	September 04, 2025 12:00 Noon	September 17, 2025 From
	Devjibhai (Co- Borrower) Loan A/c No. LBRAJ00006450599/ LBRAJ00006456323	Paiki, T.P. Scheme No. 26, Final Plot No. 79, Plot No. 1 To 3, 35 To 38, 68, 69, Mavdi Main Road, Mavdi, Rajkot, Gujarat- 360005. Admeasuring Builtup Area 57.30 Sq. MtrFree Hold Property	Åugust 21, 2025)	Rs. 2,65, 000/-	To 01:00 PM	11:15 AM Onwards

| LBRAJ00006456323 | Builtup Area 57.30 Sq. Mtr.-Free Hold Property | Solutions Private Limited The Mortgagors/ Noticees are given a last chance to pay the total dues with further interest by September 16, 2025 before 04:30 PM else the secured asset(s) will be sold as per schedule.

The prospective bidder(s) must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer Column E) at ICICI Bank Limited, Jayhind Annex, Opp. Sharda Baug, Near Dharam Cinema, Rajkot-360001. on or before September 16, 2025 by 04:30 PM. Thereafter, they have to submit their offer through the website mentioned above on or before September 16, 2025 by 05:00 PM along with the scanned image of the Bank acknowledged DD towards proof of payment of EMD. In case the prospective bidder(s) is/ are unable to submit his/ her/ their offer through the website, then the signed copy of tender documents may be submitted at ICICI Bank Limited, Jayhind Annex, Opp. Sharda Baug, Near Dharam Cinema, Rajkot-360001. on or before September 16, 2025 by 05:00 PM. Earnest Money Deposit DD/PO should be from a Nationalised/Scheduled Bank in favour of 'ICICI Bank Limited' payable at Rajkot. For any further clarifications in terms of inspection, Terms and Conditions of the E-Auction or submission of tenders, contact ICICI Bank Employee Phone No. 7999515727.
Please note that the Marketing agencies 1. Value Trust Capital Services Private Limited., 2. Augeo Asset Management Private Limited., 3. Girnarsoft Pvt Ltd., 4. Hecta Prop Tech Pvt Ltd., have also been engaged for facilitating the sale of this property. The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons. For detailed Terms and Conditions of the sale, please visit www.icicibank.com/n4p4s

Date: August 26, 2025,

Date : August 26, 2025, Place: Rajkot

केनरा बैंक Canara Bank 📣

CORRIGENDUM

Date: 27.08.2025

Sterling Cancer Hospital, Sindhu Bhavan, Ahmedabad

March. 2021.

relation to the patient.

will be entertained after the scheduled date.

info@sterlinghospitals.com | www.sterlinghospitals.com

Appendix-IV [Under Rule 8(1)]

The Borrower's Attention is invited to Provisions of Sub-Section (8) of

The Borrowers/Guarantors/Mortgagors in particular and the public in general is

No. 509, West: Avas No. 507, North: Margin, South: Passage

Government of India भारत सरकार Ministry of Finance वित मंत्रालय Debts Recovery Tribunal-II, ऋण वसूली अधिकरण-II 3rd Floor, Bhikhubhai Chambers तीसरा माला, भिखुभाई चेम्बर्स Near Kochrab Ashram, Paldi. कोचरब आश्रम के पास, पालडी.

Phone No. (दूरभाष स) 079-26579343. Tele Fax No. 079-26579347

DEMAND NOTICE

C.D.No.3: Ms Vasantiben Maganlal Shukla C.D.No.4: Ms Khusboo Harshad Shukla C.D.No.5: Mr. Maganlal K. Shukla

C.D.No.9: M/s Oum Engineers & Consultants Pvt. Ltd., (8 to 9 at Manglam Comple

You are hereby called upon to deposit the above sum within 15 days of the receipt of

EMD to be remitted in favour of The Executive Engineer, WRD., Nanganjiyar Basin Division, Palani, Dindigul District Details of tender schedule and other details will be available from 03.09.2025 onwards in the website

Authorized Officer, ICICI Bank Limited

ભરૂચ સ્પેશ્ચલ ઓપરેશન ગ્રુપની ટીમની કાર્ચવાહી

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે ૩ની ધરપકડ



અંકલેશ્વર,તા.૨૬

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીકથી એમડી ડ્રગ્સના રવાડે ન ચઢે હે હેતુથી પોલીસ આવ્યો હતો.પોલીસે શુભમ સંજય શરૂ કરી છે.

દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પઈન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને ડ્રગ્સના વેચાણ અંગેની મળેલી જથ્થા સાથે ત્રણ આરોપીઓની બાતમીના આધારે અંકલેશ્વરની ધરપકડ હતી,અને ડ્રગ્સ અને કાર વાલિયા ચોકડી નજીક આવેલ છે.આરોપીઓ છૂટકમાં ડ્રગ્સનું સહિત કુલ રૂપિયા ૧૨ લાખનો ઓમકાર-૨ની સામે ન્યુ સીટી વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કોમ્પ્યુટરની પાછળ બાબરનાથની છે.અને આ ડ્રગ્સ ક્યાંથી લાવીને કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ ચાલમાં રેઇડ કરતા આરોપીઓ તેનો વેપલો કરવામાં આવતો હતો જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના પાસેથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મળી તે અંગેની પીએન પોલીસે તપાસ

પરીહાર, રહે. નીલકંઠ સોસાયટી, ^દ્રિય્ઝ વર્કશોપ પાસે, અંકલેશ્વર, જગદિશ શેલાભાઇ ભરવાડ રહે.૨૨, રચનાનગર, રાજપીપળા ચોકડી, અંકલેશ્વર અને વસીમરાજા મોહમદ હનીફ શેખ, રહે.૧૧૪ મન્નત સોસાયટી,આંબોલી રોડ, અંકલેશ્વરની ધરપકડ કરી હતી,અને તેઓ પાસેથી રૂપિયા ૭૯,૪૦૦ની કિંમતનું એમ.ડી.ડ્રગ્સ, મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા ૧૨.૦૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

આમોદ નેશનલ હાઈવે નં. ૬૪ ઉપર કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

આમોદ પાસેથી પસાર થતી નેશનલ હાઈવે નંબર ૬૪ અત્યંત બિસ્માર બનતાં સામાન્ય પ્રજા અને વાહનચાલકોનો અવાજ બનવા માટે આમોદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય બિસ્માર હાલત બાબતે ઓટોરીક્ષા સંજયસિંહ સોલંકી સહિત કૉંગ્રેસી કાર્યકરોએ આમોદ ચાર રસ્તા ઉપર કરી હતી અને રીક્ષાને પણ બિસ્માર સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો. ૨૫ વર્ષની રોડની ગેરંટી દ મહિનામાં વિખરાઈ ગઈ" વાળા બેનર હેઠળ કૉંગ્રેસી કાર્યકરો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા. આમોદ નેશનલ હાઈવે નંબર ૬૪ ચોમાસામાં અત્યંત બિસ્માર બનતાં મસમોટા ખાડાઓ પડી ગયા હતા જેના કારણે છેલ્લા પાંચ દિવસમાં પાંચ અકસ્માતના બનાવો બન્યા હતા.છતાં તંત્રના પેટનું પાણી નહીં હાલતા આજ રોજ કૉંગ્રેસી આગેવાનોએ આમોદ ચાર રસ્તા ઉપર વિશાળ બેનર સાથે ચક્કાજામ કર્યું હતું. જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી

મારું જૂનું નામ ચેલ્નાબેન દિપકકુમાર પટેલ હતું અને નવું નામ ચેતનાબેન દિપક્કુમાર પટેલ કર્યું છે.

વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ

કેતન મકવાણાં, જંબુસર તાલુકા

કોંગ્રેસ કમિટી પ્રમુખ શરદસિંહ

સરનામું : કાશીપુરા, વડનગર - મહેસાણા



RELOCATION BRANCH OFFICE All our Customers, Constituents and Members of Public are here by informed that our Branch office located at 2nd floor,201 A, Pancham Icon, Near D-Mart Vasna Road, Vadodara-39000 India will be relocated and would remain operational from My Branch Offices at Opulence, office no. 910 to 913 and 921 to 923, 9th Floor, 73, East Avenue, Sarabha Campus, Genda Circle, Vadodara: -390017 India w.e.f Thursday. October 30 - 2025. Additionally, for any queries , feel free to contact us at our toll-free number 1800 22 4030 / 1800 200 4030/1800 200 5142 or write tous on contactus@universalsompo.com. We shall be

most pleased to service you at al

રાણા ,જીલ્લા કોંગ્રેસના મંત્રી બાબુ બરફવાલા સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસી આગેવાનોએ આંદોલન પોલીસ ઇન્સ્પેકટર , નાયબ સમયે આમોદ પોલીસે તેમને ડિટેન કર્યા હતા. નેશનલ હાઈવે રોડની ચાલકોએ પણ પોતાની વેદના વ્યક્ત રોડને કારણે આર્થિક નુકશાન થતું હોવાનું જણાવ્યું હતું.

કોંગ્રેસના બે આગેવાનોએ અન્ન જળનો ત્યાગ કર્યા બાદ આમોદના પોલીસ અધિક્ષક તેમજ કલેકટર સાથે નેશનલ હાઈવે ઓથોરિટના અધિકારીઓ સાથે સંકલન કરી નિરાકરણ લાવતા કોંગ્રેસના બે આગેવાનો નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ કેતન મકવાણાએ ઉપવાસનો ત્યાગ કરી પારણા કર્યા હતા.

જાહેર સૂચના પર્ચાવરણીય મંજુરી

આ સાથે જણાવવામાં આવે છે કે સ્ટેટ લેવલ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરીટી, પર્ચાવરણ ભવન, સેક્ટર ૧૦/એ, ગાંધીનગર-૩૮૨૦૧૦ દ્વારા **મેસર્સ** સમન્વચ કેમીકલ્સ પ્રાઇવેટ લિમિટેક, જુનો સર્વે નં ૧૧૩, બ્લોક નંબર : ૩૭, ગામ ઃ કોલીયાંક, તા. વાગરા, જી. ભરૂચ ૩૯૨૧૪૦, ગુજરાત ખાતે સીંથેટીક ઓર્ગેનીક કેમીકલ્સ ના સૂચિત ઉત્પાદન પ્લાન્ટ ને વિભાજીત માટેની પર્ચાવરણ મંજુરી ફાઇલ નં : SEAC/GJ/IND3/496613/75612/2024 અને તા ૧૮ જુલાઇ, ૨૦૨૫ ના પત્ર ક્રમાંક ઃ EC24B2410GJ5237809N દ્વારા ઈ.આઇ.એ નોટીફીકેશન તારીખ ઃ ૧૪ મી સપ્ટેમ્બર ૨૦૦૬ ની જોગવાઇ हેઠળ આપેલ છે.

કલીચરન્સ પત્રની નકલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને MoEF&CC ની વેબસાઇટ parivesh.nic.in ઉપર ઉપલબ્ધ છે.

સ્થળ : કોલીચાડ, વાગરા, ભરૂચ તારીખ : ૨૫-૦૮-૨૦૨૫

મેસર્સ સમન્વય કેમીકલ્સ પ્રાઇવેટ લિમિટેક વતી ઓથોરાઇઝડ સીગ્નેચર

બેંક ઓફ ઇન્ડિયા बैंक ऑफ इंडिया વાસણા–ભાચલી રોડ શાખા મેટ્રીક્ષ કોમ્પ્લેક્ષ, ઓજસ પાર્ક સોસાયટી, વાસણા–ભાયલી રોક, વકોદરા–૩૯૦૦૧૫ Bank of India પરિશિષ્ટ – IV-[રૂલ ૮ (૧)] કબજા અંગેની નોટિસ (સ્થાવર મિલ્કત માટે)

આથી નીચે સહી કરનાર બેંક એક ઇન્ડિયા - વાસણા ભાયલી શાખા ના અધિકત અધિકારી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ વટહુકમ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) ના રૂલ્સ ૩ સાથે વાંચતા કલમ ૧૩(૧૨) અન્વચે પ્રાપ્ત અધિકારોની રૂએ તારીખ **૧૦.૦૬.૨૦૨૫** કિમાન્ડ નોટીસ પાઠવી કરજદાર શ્રી**મતી** ભાવિષા કેતનભાઈ પટેલ અને શ્રી કેતનભાઈ અંબાલાલ પટેલ ને નોટીસ માં દર્શાવેલ રકમ રૂા. ૧૨,૩૫,૩૨૪.૭૩ (અંકે રૂપિયા બાર લાખ પાંત્રીસ હજાર ત્રણસો ચોવીસ અને પૈસા તોતેર પુરા) – નોટિસની તારીખ સુધીના કરારના બાકી લેણાં માસિક બાકી રકમ સાથે @૧૧.૩૫% વાર્ષિક વ્યાજ સાથે, આ નોટિસની તારીખથી ૬૦ દિવસની અંદર બેંક ઓફ ઈન્ડિયાને આકસ્મિક શુલ્ક, ખર્ચ વગેરે સહિત ચૂકવવા પડશે.

કરજદારો અને તે મિલકતના માલિક, જે રકમ ચૂકવવામાં નિષ્ફળ થયેલ છે, આથી કરજદાર અને તે મિલકતના માલિક, જામીનદાર અને જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે શ્રીમતી ભાવિષા કેતનભાઈ પટેલ ને અહીં નીચે દર્શાવેલ મિલકતનો સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ રૂલ-૮ સાથે સંચાતા ઉક્ત (એક્ટ) ના સેક્શન ૧૩(૪) **હેઠળ મને પ્રાપ્ત થચેલ સત્તાનો ઉપ**યોગ કરી **તા. ૨૧.૦૮.૨૦૨૫ ના રોજ** સાંકેતિક કબજો લેવામાં આવેલ છે.

મિલકતના માલિક, કરજદાર અને જામીનદાર તથા જાહેર જનતાને સદર મિલ્કત સંદર્ભે કોઇપણ પ્રકારનો વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે તેમજ જો કોઇ પણ વ્યવહાર કરશો તો સદર વ્યવહાર **બેંક ઓફ ઇન્ડિયા, વાસણા ભાયલી રોડ શાખા** ની લેણી રકમ રા. ૧૨,૩૫,૩૨૪.૭૩ (અંકે રૂપિયા બાર લાખ પાંત્રીસ હજાર ત્રણસો **ચોવીસ અને પૈસા તોતેર પુરા**) – નોટિસની તારીખ સુધીના કરારના બાકી લેણાં, વાર્ષિક @૧૧.૩૫% ના દરે વધુ વ્યાજ સાથે, માસિક બાકી રકમ બેંક ઓફ ઇન્ડિયાને વ્યાજ, આકસ્મિક શુલ્ક, ખર્ચ વગેરે સાથે.

કરજદારો મિલકત છોડાવવા ઉપલ્બધ સમય બાબતે એક્ટના સેક્શન ૧૩ ના સબ-સેક્શન (૮) ની જોગવાઇ તરફ ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલ્કત નું વર્ણન ઇકવેટીબલ મોર્ટગેજર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો આવેલ તે બ્લોક નં. ૨૪ ક્ષેફિળ ૫૯–૨૫ ચોરસ મીટર, પ્લોટ એરીયા સાથે અવિભાજીત ક્રોમન રોડ અને પ્લોટ એરીયા ૪૬–૫૫ ચોરસ મીટર કુલ બનેલ એરીયા ૧૦૫–૮૦ ચોરસ મીટર અને તેના પર, લવકુશ નગરી, વડસર રોડ, વડોદરા તરીકે ઓળખાતી ચોજનામાં બાંઘકામનો પ્રસ્તાવ મૂક્યોં હતો જમીન નો આર.એસ. નં. ૧૨७ અને ૧૨૯/૧, સી.એસ. નં. ૧૨७૩ અને ૧૨૦૧ અને સીટ નં. ૭૧ ગામ મોજે વડસર તાલુકો અને જીલ્લો વડોદરા અને રજીસ્ટ્રેશન જીલ્લો અને સબ જીલ્લો વડોદરા-૩૯૦૦૧૦ અને ચતુર્સીમાઃ પૂર્વ બાજુઃ બ્લોક નં. ૨૩, પશ્ચિમ બાજુઃ ૬.૦૦ મીટર સોસાયટી રોક, ઉત્તર બાજુઃ હ.૫ મીટર સોસાયટી રોક, દક્ષિણ બાજુઃ ઓપન સ્પેસ પછી બ્લોક નં. ૨૫.

અધિકૃત અધિકારી બેંક ઓફ ઇન્ડિયા તા.: ૨७.०८.૨૦૨૫

Head Administration केनरा बैंक Canara Bank 📣 डेनेरा બेंड - इतेह्गं४ शाजा ૧લો માળ, સિલ્વરબેલ કોમ્પ્લેક્ષ, એસ.બી.આઈ સામે. (३५स ८(१) हेहण सिड्योरिटी ફતેહગંજ, વડોદરા-૨. ફોનઃ ૦૨૬૫-૨७૮૫૩૦૦

આથી નીચે સહી કરનાર કેનેરા બેંક, ફતેહગંજ શાખા, ૧લો માળ, સીલ્વરબેલ કામ્પ્લેક્ષ, એસબીઆઇ ની સામે, ફતેહગંજ, વડોદરા-3૯૦૦૦૨ ના અધિકૃત અધિકારીએસિક્ચોરિટાઇઝેશન અને રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ ના રૂલ્સ ૩ સાથે વાંચતા સેકશન ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત થયેલ સત્તાની રૂએ કરજદાર **વકારઅલી હસમતઅલી સૈયદ (કરજદાર)** ને તારીખઃ ૨૫.૦૩.૨૦૨૫ના રોજ ડીમાન્ટ/માંગણા નોટીસ પાઠવીદે નોટીસમાં દર્શાવેલ રકમ **રૂા.૧૧,૨૪,૦૦૯.૪૯** (એકે રૂપિયા અગીયાર લાખ ચોવીસ **દજાર** નવ અને પૈસા ઓગણપાચાસ પુરા) નોટિસમાં દર્શાવેલ વ્યાજ સાથે, ઉપરોક્ત નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ભરપાઇ કરવા જણાવેલ છે.

કરજદાર રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી, તેમને અને સામાન્ય જનતાને સૂચના આપવામાં આવે છે કે નીચે સહી કરનાર વ્યક્તિએ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વાંચેલા કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ (૪) हેઠળ આ અંગે હુકમ 03/0७/૨૦૨૫ ના રોજ માનનીચ ચીફ જ્યુડિશિચલ મેજિસ્ટ્રેટ, વડોદરા દ્વારા CRMA નં. ૪૬૦७/૨૦૨૫ માં કલમ ૧૪ **હેઠળ તેમને** મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને નીચે વર્ણવેલ મિલકતનો **તા. ૨૩.૦૮.૨૦૨૫ ના રોજ પ્રત્યક્ષ કબજો** લીધો છે.

કરજદાર તથા જાહેર જનતાને સદર મિલ્કત સંદર્ભે કોઇપણ પ્રકારનો વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે તેમજ જો કોઇ તેમજ જો કોઈ પણ વ્યવહાર કરશો તો સદર વ્યવહાર **કેનેરા બેંક** ની બાકી લેણી રકમ **રૂા.૧૧,૨૪,૦૦૯.૪૯** (એકે રૂપિયા અગીયાર લાખ ચોવીસ હજાર નવ અને પૈસા ઓગણપાચાસ પુરા) અને તેના પરનું વધુ વ્યાજ પ્લસ અન્ય ચાર્જ ને આધિન રહેશે.

સિકચોર્ડ મિલકત છોડાવવા ઉપલબ્ધ સમય બાબતે ઉક્ત એક્ટના સેકરાન ૧૩ ના સબ–સેકરાન (૮)ની જોગવાઇ તરફ કરજદારનું ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલ્કત નું વર્ણન

તમામ ભાગ અને હિસ્સો બિન ખેતીલાચક પ્લાટ ની જમીન મોજે ફતેહપુરા, વડોદરા અને જમીન વિભાગ–એ, ટીક્કા નં. ૨૨/૨ એકીકૃત સી.એસ. નં. ૧૪ (જુનો સી.એસ. નં. ૧૪, ૫૬/એ, ૫૬/બી, ૫૮) જે 'વી. એમ. ચેમ્બર્સ' તરીકે ઓળખાય છે ગ્રાઉન્ડ ફલોર, જી.એફ. નં. ૦૨, ક્ષેત્રફળ ૨૩.૨૩ ચોરસ મીટર એટલે કે ૨૫૦ ચોરસ ફુટ નો રજીસ્ટ્રેશન સબ જીલ્લો અને જીલ્લો વડોદરા ગુજરાત (Security Id - 400051822779), ચતુર્સીમાઃ ઉત્તરઃ એપાર્ટમેન્ટની ખૂલી જગ્યા. દક્ષિણ અત્તા–એ–નાસીર બિલ્ડીંગ, પૂર્વઃ દુકાન નં. જીએફ–૧, પશ્ચિમઃ એપાર્ટમેન્ટ સીડી.

તા.: ૨७.૦૮.૨૦૨૫ નોંધઃ વિવાદની સ્થિતિમાં આ નોટીસનો અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે. સ્થળઃ વડોદરા

અધિકૃત અધિકારી - કેનેરા બેંક – વડોદરા.

બેંક ઓફ બરોડા - સચાજીગંજ શાખા 🎉 बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

યશ કમલ, લોક માન્ય તીલક રોડ, સચાજીગંજ, વડોદરા – ૩૯૦૦૨૫, ફોનઃ ૦૨૬૫-૨૩૬૧૮૯૩, ઇમેલઃ sayaji@bankofbaroda.com

આથી નોટીસ આપવામાં આવે છે કે નીચેના કરજદાર તેમણે મેળવેલી ધિરાણ સવલતો લીધેલ જેની મૂળ રકમ અને વ્યાજ ભરવામાં કસૂર કરેલ છે અને તેમની લોનો નોન પરફોમિંગ એસેટ(એનપીએ) વર્ગીકૃત કરવામાં આવી છે. તેમને નોટીસ સિક્યુરીટાઇઝેશન અને રીકન્ટસ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ-૨૦૦૨ ની કલમ ૧૩(૨) અંતર્ગત તેમના છેલ્લા અને જાણીતા સરનામા ઉપર પાઠવવામાં આવેલ પરંતુ તે પરત થયેલ છે તેથી નીચે મુજબ આ જાહેર સૂચના દ્વારા જાણ

કરજદાર/જામીનદાર નુ નામ	નેચર અને સુવિધા નો પ્રકાર	વ્યાજ નો દર	નોટિસની તારીખ મુજબ બાકી (કરાર લેણાં) (નોટિસની તારીખ સુધીના વ્યાજ સહિત)	સિક્યોરિટીઝના સંક્ષિપ્ત વર્ણન સાથે સુરક્ષા કરાર
અંજલી પ્રકાશકુમાર સુર્ચવંશી જે પ્રકાશકુમાર બલવંતરાવ સુર્ચવંશી ની પુત્રી અને નિલ પંકજ કુમાર શેઠ જે પંકજકુમાર કૃષ્ણકાંત ના પુત્ર	ર્ટમ લોન હાઉસીંગ લોન	9.60% Per annum with monthly rests at present	પ્રિન્સીયલ: ફા.૨૭૫૨૨૮.૪૧ @ રેટ ૯.૬૦ તે હાલ: ૫૮७૩૨.૯૦ કુલ– ફા.૧૧,૨૯,૧૯૭.૯૦	પ્લોટ ની જમીન મોજે કસબા વડોદરા, વિભાગ–એ, ટીક્કા નં. ૮/૨ સી.એસ. નં. ૩૫૩, ૩૫૪, ૧૨૩, .
ફ્લેટ નંબર ૧૦૩, પહેલો માળ સાઈ શ્થામ ફ્લેટ એપાર્ટમેન્ટ ડબોહિયા પોળ વાડી, શનિદેવ મંદિર, વડોદરા. જામીનદારઃ દેવાંગ ભાટીયા જે દિનેશભાઈ ભાટીયા ના પુત્ર,	ર્દમ લોન ટોપ અપ લોન	10.25% Per annum with monthly rests at present	પ્રિન્સીપલ: રૂા.૨७૫૨૨૮.૪૧ વ્યાજ તા. ૩૧.૦૭.૨૦૨૫ સુધી @ રેટ ૧૦.૨૫% તે હાલ: ૧૬૯૩૪.७૯ કુલ– રૂા.૨,૯૨,૧૬૩.૨૦	ફલેટ નં. ૧૦૩ ક્ષેત્રફળ ૩૯.૯૬ ચોરસ મીટર અંજલિ પ્રકાશકુમાર સૂર્થ વંશી જે પ્રકાશકુમાર બળવંતરાવ સૂર્થવંશી ની પુત્રી અને નીલ પંકજ કુમાર સેઠ જે પંકજ
રપ વાંચાલી પોલ, શનિદેવ મંદિર પાસે, વાડી એસ.એન. રોડ, વડોદરા–૩૯૦૦૧७. કિમાન્ડ નોટીસ તાઃ ૦૨.૦૮.૨૦૨૫ એન.પી.એ. તાઃ ૧૪.૦૫.૨૦૨૫ નોરીસ લજલાથી પ્રાપ્તના અન્ય પ્રાપ્ત		કુલ	પ્રિન્સીપલ: ફા.૧૩,૪૫,૬૯૩.૪૧ વ્યાજ તા. ૩૧.૦૫.૨૦૨૫ સુધી @ રેટ ૧૦.૨૫% તે હાલ: ૫૫,૬૬૫.૬૯ કુલ– ફ્રા.૧૪,૨૧,૩૬૧.૧૦	કુમાર કૃષ્ણકાંત શેઠ ના પુત્રની માલિકીની. ચતુર્સીમાઃ લેન, પશ્ચિમઃ ઓટીએસ, ઉત્તરઃ સી.એસ. નં. ૧૨૧, દક્ષિણઃ સી.એસ.નં.૧૨૮.

નોટીસ પ્રસિધ્ધ થયાના ૬૦ દિવસની અંદર બાકી રકમની ચૂકવણી કરવા જણાવવામાં આવે છે. તેમા કસૂર થતાં આ નોટીસ ની તારીખ થી ૬૦ દિવસ પૂરા થયા બાદ સિક્યુરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ–૨૦૦૨ ની કલમ ૧૩ ની પેટા કલમ (૪) મુજબ આગળ પગલા ભરવામાં આવશે.

તા. ૨७.૦૮.૨૦૨૫– સ્થળઃ વડોદરા

નોંધઃ વિવાદની સ્થિતિમાં આ નોટીસનો અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે

અધિકૃત અધિકારી – બેંક ઓફ બરોડા

केनरा बैंक Canara Bank \Delta डेनेरा लेंड -भां४ सपुर शाजा ગ્રાઉન્ડ ફલોર, દુકાન નં. ૧ અને ૨ ફિમ આઇકોન, રમેશ પટેલ ફાર્મ પાસે પાટીદાર કોમ્પ્લેક્સ, ન્યુ આઈપી રોડ, માંજલપુર ભારત, વડોદરા,૩૯૦૦૧૧

(રૂલ્સ ૮(૧) હેઠળ સિક્યોરિટી ન્ટરેસ્ટ(એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ આથી નીચે સહી કરનાર કેનેરા બેંક, માંજલપુર શાખા, ગ્રાઉન્ડ ફલોર, દુકાન નં. ૧ અને ૨, ડ્રિમ આઇકોન, રમેશ પટેલ ફાર્મ પાસે પાટીદાર કોમ્પ્લેસ, ન્યુ આઇપી રોડ, માંજલપુર, વડોદરા-૩૯૦૦૧૧ ના અધિકૃત અધિકારીએસિક્ચોરિટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ ના રૂલ્સ ૩ સાથે વાંચતા સેકશન ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત થયેલ સત્તાની રૂએ કરજદાર ૧) **મેસર્સ ડિ.જી. એન્ટરપ્રાઇઝ (કરજદાર) ૨) દિનેશભાઇ વિજયભાઇ ગોહિલ (માલિક અને મોર્ટગેજર)** ને તારીખઃ ૩૧.૦૧.૨૦૨૫ના રોજ ડીમાન્ટ નોટીસ પાઠવી ને નોટીસમાં દર્શાવેલ રકમ **રૂા. ૫૪,**

સાથે, ઉપરોક્ત નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ભરપાઈ કરવા જણાવેલ છે. કરજદાર રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા हોવાથી, તેમને અને સામાન્ય જનતાને સૂચના આપવામાં આવે છે કે નીચે સહી કરનાર વ્યક્તિએ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વાંચેલા કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ (૪) हેઠળ આ અંગે हુકમ ૦૧/૦७/૨૦૨૫ ના રોજ માનનીય ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા દ્વારા CRMA નં. ૧૦૮/૨૦૨૫ માં કલમ ૧૪ हેઠળ તેમને મળેલી

૬७,૦૩૬.૬૫ (રૂપિયા ચોપ્પન લાખ સડસઠ હજાર છત્રીસ અને પૈસા પાંસજી **પુરા**) તા. ૩૧.૦૧.૨૦૨૫ ના રોજ નોટિસમાં દર્શાવેલ વ્યાજ

સત્તાઓનો ઉપયોગ કરીને નીચે વર્ણવેલ મિલકતનો તા. ૨૪.૦૮.૨૦૨૫ ના રોજ પ્રત્યક્ષ કબજો લીધો છે. કરજદાર તથા જાહેર જનતાને સદર મિલ્કત સંદર્ભે કોઇપણ પ્રકારનો વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે તેમજ જો કોઇ તેમજ જો કોઇ પણ વ્યવહાર કરશો તો સદર વ્યવહાર કેનેરા બેંક ની બાકી લેણી રકમ 31. ૫૪. ૬७.૦૩૬.૬૫ (3પિયા ચોપ્પન લાખ સકસઠ દજાર છત્રીસ અને પૈસા પાંસ રૂ પુરા) તા. ૩૧.૦૧.૨૦૨૫ ના રોજ અને તેના પરનું વધુ વ્યાજ પ્લસ અન્ય ચાર્જ ને આધિન રહેશે.

સિકચોર્ડ મિલકત છોડાવવા ઉપલબ્ધ સમય બાબતે ઉક્ત એક્ટના સેકશન ૧૩ ના સબ–સેકશન (૮)ની જોગવાઇ તરફ કરજદારનું ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલ્કત નું વર્ણન

તમામ ભાગ અને હિસ્સો બિન ખેતીલાચક ઇન્ડસ્ટીચલ જમીન નો પ્લોટ નં. ૨૬૪, ક્ષેત્રફળ આશરે ૪૫૮.૬૧ ચોરસ મીટર અથવા તેમાં સમાવેશ થાય છે ક્રમ નં. ૧૧૫૪ પૈકી આવેલ તે 'સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફાસ્ટ્રક્ચર પાર્ક' ગામ વાધોડિયા, તાલુકો વાધોડિયા, રજીસ્ટ્રેશન સબ જીલ્લો વધોડિયા માં, રજીસ્ટ્રેશન જીલ્લો વડોદરા જે શ્રી ગોહિલ દિનેશ વિજ્યભાઈ ના નામે છે. ચર્તુસીમાઃ ઉત્તરઃ લાગુ સર્વે નં. ૧૧૫૩, દક્ષિણઃ રોડ, પૂર્વઃ પ્લોટ નં. ૨૬૫, પશ્ચિમઃ પ્લોટ નં. ૨૬૩.

તા.: ૨७.૦૮.૨૦૨૫ સ્થળઃ વડોદરા

નોંધઃ વિવાદની સ્થિતિમાં આ નોટીસનો અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે.

પશ્ચિમ રેલવે સામાહિક વિશેષ ટ્રેનોની ૬ જોડીની ટ્રીપ લંબાવશે

ट्रेन नंબर	થી	સુધી	सेवाना हिवस	થી વિસ્તૃત
૦૯૦૭૫	મુંબઈ સેન્ટ્રલ	કાઠગોદામ	બુધવાર	૩૧.૧૨.૨૦૨૫
06038	કાઠગોદામ	મુંબઈ સેન્ટ્રલ	ગુરુવાર	०१.०१.२०२६
૦૯૧૮૫	મુંબઈ સ ેન્ ટ્રલ	કાનપુર અનવરગંજ	રવિવાર	ર૮.૧૨.૨૦૨૫
०५१८६	કાનપુર અનવરગંજ	મુંબઈ સેન્ટ્રલ	સોમવાર	ર૯.૧૨.૨૦૨૫
06083	બાંદ્રા ટર્મિનસ	બહીની	રવિવાર	ર૮.૧૨.૨૦૨૫
०७०४४	બહીની	બાંદ્રા ટર્મિનસ	સોમવાર	ર૯.૧૨.૨૦૨૫
0୯00૭	વલસાડ	ખાતીપુરા	ગુરુવાર	30.10.2024
06005	ખાતીપુરા	વલસાડ	શુક્રવાર	૩૧.૧૦.૨૦૨૫
०७११७	ઉધના	સુબેદારગંજ	શુક્રવાર	રફ.૧૨.૨૦૨૫
०५११८	સુબેદારગંજ	ઉધના	શનિવાર	ર૭.૧૨.૨૦૨૫
૦૯૧૯૫	વડોદરા	મઉ	સોમવાર	ર૯.૧૨.૨૦૨૫
०୯१୯६	મઉ	વડોદરા	મંગળવાર	૩૦.૧૨.૨૦૨૫

રોકાણ, રોકાણના સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો ફૂપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

્ટ્રેન નંબર ૦૯૦७૫, ૦૯૧૮૫, ૦૯૦૪૩, ૦૯૦૦७, ૦૯૧૧७ અને ૦૯૧૯૫ ની વિસ્તૃત ટ્રિપ્સનું બુકિંગ ૨૮.૦૮.૨૦૨૫ થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટેનો ખાસ ભાડા પર વિશેષ ટેનો તરીકે દોડશે.

ઈ-ટેન્ડર



પશ્ચિમ રેલવે અમને ફોલો કરો: : 💹 X.com/WesternRh અમને ફોલો કરો: @Instagram/WesternRiv

અંદાજીત એન

આઈટી ખર્ચ (₹)

EMD

ખર્ચ (₹)

કૃપા કરીને બધી આરક્ષિત ટિકિટો માટે મૂળ ઓળખપત્ર સાથે રાખો.

પશ્ચિમ રેલવે - અમદાવાદ ડિવિઝન વિવિધ એન્જિનિયરિંગ કાર્ય <u>ઈ-ટેન્ડર નોટિસ નં. 11 વર્ષ 2025-26 તારીખ 22/08/2025</u>

કામનું નામ

01	DRM-ADI- 116-2025-26	ડિવિઝનલ એન્જિનિયર (ઉત્તર)-અમદાવાદના અધિકારક્ષેત્ર હેઠળ કેબલ ડક્ટ/પ્લેટફોર્મ ડ્રેઇન અને અન્ય પેસેન્જર કોય સૂયક બોર્ડ અને લાઇટિંગના જોડાણમાં અન્ય આનુષંગિક કાર્યો સાથે સુવિધાઓનું કામ.	8,31,40,216.78	5,65,700.00
02	DRM-ADI- 117-2025-26	ગાંધીધામ મેગા ડેપો-ડેપો પર મશીન ક્રશ્ડ ટ્રેક બેલાસ્ટનું ઉત્પાદન, પુરવઠો અને સ્ટેકીંગ અને તેને હોપરમાં લોડ કરવું. (કુલ-165000 કમ).	18,12,90,450.00	10,56,500.00
03	DRM-ADI- 118-2025-26	ગાંધીધામ- સ્ટેડિયમ અને કોમ્યુનિટી હોલમાં રહેવાની વ્યવસ્થા અને સુવિધાઓમાં વધારો અને અન્ય આનુષંગિક કાર્યો.	2,00,50,386.65	2,50,300.00
04	DRM-ADI- 119-2025-26	સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (એનડબ્લ્યુ)-અમદાવાદના અધિકારક્ષેત્ર હેઠળ ગાંધીધામ આદિપુર વિભાગને યાર ગણો બનાવવા અને ગાંધીધામ અને આદિપુર કોલોની માટે ડક્ટાઇલ આયર્ન (ડી.આઈ.) પાણીની પાઇપલાઇન નાખવાના સંદર્ભમાં ભયાઉ સ્ટેશનના બેલેન્સ કાર્યો અને અન્ય સંબંધિત કાર્યો.	3,99,56,744.77	3,49,800.00
05	DRM-ADI- 120-2025-26	પાલનપુર સબ ડિવિઝન - પાલનપુર (સહિત) થી મીઠા (સહિત) વચ્ચે કોલોનીઓ, ગેંગ્સ અને વિવિધ લેવલ ક્રોસિંગ પર રોડ ટેન્કર દ્વારા પીવાના પાણીનો પુરવઠો. બે વર્ષ માટે (પુન: આમંત્રણ)	21,55,480.59	43,100.00
06	DRM-ADI- 121-2025-26	ડિવિઝનલ એન્જિનિયર (ઉત્તર)-અમદાવાદના અધિકારક્ષેત્ર હેઠળ પાલનપુર-મહેસાણા વિભાગમાં સ્ટેશન બિલ્ડીંગ, સર્વિસ બિલ્ડીંગ, સ્ટાફ ક્વાર્ટર, ફૂટ ઓવર બ્રિજ (FOB),પ્લેટફોર્મ શેલ્ટરનું રંગકામ અને અન્ય સંબંધિત કાર્યો.	2,21,19,003.62	2,60,600.00
07	DRM-ADI- 122-2025-26	સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (પશ્ચિમ) અમદાવાદના અધિકારક્ષેત્ર હેઠળ ખાખરેયી યાર્ડમાં સુધારો અને વિવિધ યાર્ડ્સ જેમ કે છારોડી, વિરમગામ, જખવાડા, ઝુંડ, જતપીપળી, આંબલી રોડમાં ખરાબ વેક્રટનું સુધારણા અને રેલ, પોઇન્ટ અને કોસિંગ સ્લીપર અને સીએમએસ ક્રોસિંગ અને અન્ય આનુષંગિક ટ્રેકનું કેઝ્યુઅલ નવીનીકરણ કામો.	4,31,56,616.48	3,65,800.00
08	DRM-ADI- 123-2025-26	સાબરમતી જંકશન - લાઇન નંબર 9 ના ડીઇ ને લંબાવીને એસબીઆયબી થી આયસીડી સુધી વૈકલ્પિક કનેકિટવિટીની વ્યવસ્થા અને લાઇન નંબર 8 ના ડીઇ ને લંબાવીને એડીઆય ખાતે	1,14,61,849.01	2,07,300.00

ઉપરોક્ત તમામ ટેન્ડર્સ માટેઃ ઈ-ટેન્ડર બંધ થવાની તારીખ અને સમયઃ તારીખ 16/09/2025 ના 15:00 ક્લાકે: ઓફિસનું સરનામુંઃ સિનિ. ડિવિઝનલ એન્જિનિયર (સમન્વય), અમદાવાદ ડીઆરએમ ઓફિસ, ચામુંડા બ્રિજ પાસેઃ ન્યુ સ્વદેશી મીલ સામે, નરોડા રોડ, અંમદુપુરા, અમદાવાદ-382345; **ઇ-ટેન્ડરમાં ભાગ લેવા માટે** વેબસાઈટ : <u>www.ireps.gov.in</u>

અમને લાઈક કરો: 🖪 facebook.com/WesternRly• અમને ફોલો કરો: 💥x.com/WesternRly

ધારકો પાસેથી બે (૧) ટેકનિકલ બિડ અને (૨) નાણાકીય બિડ. બિડ સિસ્ટમ માં સીલબંધ ટેન્ડર ખામંત્રિત કરે છે. નવી પ્રસ્તાવિત **દેવહત શાખા** મોટે યોગ્ય જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર બિલ્ટ-અપ (તૈયાર જ અથવા 3-4 મહિનાના સમયગાળામાં તૈયાર થવાની સંભાવના ધરાવતી જગ્યા) હોવી જોઈએ જેનો કાર્પેટ એરિયા **1000 - 1330 ચોરસ ફૂટ / બેંકની જરૂરિયાત મુજબ હોવો જોઈએ.** પ્રસ્તાવિત જગ્ટ વોજળી સહિતની તમામ સુવિદ્યાઓ હોવી જોઈએ. રસ ઘરાવતા અરુજદારે "ટેકનિકલ બિડ" અને "ફાઇનાનિસ્થિલ બિડ" તરીકે ચિહિત બે અલગ સીલબંધ પરબિડીચાઓમાં દરખાસ્ત રજૂ કરવી જોઈએ અને તેમને મોટા પરબિડીચામાં મૂકીને સબમિટ કરવી જોઈએ પરબિડીચું ઉપર લખેલું હોયું જોઈએ "નવી પ્રસ્તાવિત દેવલત શાખા માટે ટેલ્ડર ઓફર્સ", અરુજદારનું નામ, સંપૂર્ણ સરનામું અને સંપર્ક નંબર, પ્રસ્તાવિત દેવહત શાખા માટે ટેન્ડર ઓફર", અરજદારનું નામ, સંપૂર્ણ સરનામું અને સંપર્ક નળર યોગ્ય રીતે સીલબંધ અને પ્રાદેશિક મેનેજર (સહાયક જનરલ મેનેજર), બેંક ઓફ બરોડા, પ્રાદેશિક કાર્યાલય, ને મોકલવામાં આવે. બરોડા ડિસ્ટ્રિક્ટ એરિયા, છઠ્ઠો માળ, સૂરજ પ્લાઝા-III, સંચાજીગંજ વડોદરા-૩૯૦૦૨૦ માટે ૧૦.૦૯.૨૦૨૫ ના રોજ સાંજે ૫-૦૦ સુધી અથવા તે પહેલાં ફક્ત ઓફલાઇન મોડ હારા જ અરજીઓ સબમિટ કરવી આવશ્ચક છે.

બેંક કોઈપણ કારણ આપ્યા વિના કોઈપણ ઓફર સ્વીકારવા અથવા નકારવાનો અધિકાર અનામત રાખે છે . ક્લિકલ બિડ અને સદાના@ાયલ બિડના બેંક સેમેંટ અમારી બેંકની વેબસાદાટ પ્રસ્થી ડાઉનલોડ કરી શકાય છે.

	www.bankorbaroua.in/tenders.asp						
અ.નં.	કેન્દ્રો/સ્થળ	ઝુલ્લો	કાર્પેટ એરિયા	એરિયા			
1	દેવહત	છોટા ઉદેપુર	૧૦૦૦-૧૩૩૦ ચો.ક્રુટ બેંક ની જરૂરીયાત અનુસાર	રુરલ			
તારીખઃ ૨૯.૦૮.૨૦૨૫ સ્થળ : વડોદરા		રીજનલ મેનેજર (સહાયક મ બરોડા દ્	હાપ્રબંધક યુલ્લા પ્રદેવ				

Bank of Baroda

APPENDIX IV [See Rule 8(1)] મિલકતના કબજાને લગતી સુચના (અચલ મિલકત) નીચે સહી કરનાર સીક્યુરીટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફ્રાંસનાન્સીયલ એસેટ્સ એન્ એન્ફોર્સમેન્ટ ઓફ સીક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ તે કલમ ૧૩(૧૨) ના (નિયમ –૮ ની સાથે વાંચતા સીક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ મળેલા અધિકારો હેઠળ **બેંક ઓફ બરોડા** ના અધિકૃત અધિકારીની રૂઈએ નીચે જણાવેલ બાકી કરજદાર / જામીનદાર ⁄મોર્ટગેજર શ્રી સંતરામ રામદેવ બનીયા અને શ્રીમતી ગીતાબેન સંતરામ બનીયા ને ડીમાન્ડ **નોટીસ તા.03.૧0.૨0૨૪** ના પાઠવીને નોટીસ માં બાકી ખાતેદાર સામે દર્શાવેલી રકમ 3 ૧૬.૮૫.૩૪૧.૯૭ (રા.સોળ લાખ પંચ્ચાસી હજાર ત્રણસો એકતાલીસ અને પૈસા સત્તાણ **પુરા) તા. 03.૧0.૨0૨૪** ના રોજ નોટિસની તારીખ/ઉક્ત નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર વધુ વ્યાજ અને ખર્ચ સાથે.

કરજદાર/જામીનદાર/મોર્ટગેજર નીચે જણાવેલી રકમોની પરત ચકવણી કરવામાં નિષ્ફળ ગય હોવાથી, આ સાથે બાકી કરજદાર/જામીનદાર/મોર્ટગેજર અને જાહેર જનતાને જણાવવામ આવે છે કે નીચે સહી કરનારે અત્રે આવેલા કોષ્ટકમાં દર્શાવેલી મિલકતનું ઉપર જણાવેલ નીયમોના સીક્યુરીટી ઇન્ટરેસ્ટ એનફોર્સમેન્ટ રૂલ્સ ૮ ને સબંધીત કલમ ૧૩(૪) સાથે વટફુકમ એક્ટ વાંચતા તેને/તેણીને પ્રાપ્ત થતી સત્તાઓ અનુસાર **મિલકત નો પ્રત્યક્ષ કબ**જો તા.૨૪.૦૮.૨૦૨૫ ના રોજ લીધો છે.

બાકી કરજદાર/જામીનદાર/મોર્ટગેજર તથા સામાન્ય સંદર્ભમાં જાહેર જનતાને અત્રે નીરે જણાવેલી અનુસૂચિત મિલકતની બાબતમાં કોઈપણ પ્રકારનો વ્યવહાર કે લેવડ દેવડ ન કરવ ચેતવણી આપવામાં આવે છે, **બેંક ઓફ બરોડા, ખોડિયાર નગર શાખા** ની લેણી રકમ **રૂા** ૧૬,૮૫,૩૪૧.૯૭ (રૂા.સોળ લાખ પંચ્ચાસી હજાર ત્રણસો એકતાલીસ અને પૈસા સત્તાણું પુરા) તા. 03. ૧૦. ૨૦૨૪ ના રોજ પ્લસ વધુ વ્યાજ અને તેના પરના અન્ય શુલ્ક.

દેવાદારને ધ્યાન દોરવામાં આવે છે કે પોતાની મિલકત સેક્શન ૧૩ ના એક્ટ હેઠળ સબ સેક્શન (૮) મુજબ મિલકત મેળવવા રકમ ભરવા સમયની જોગવાઈ કરવામાં આવી છે.

અચલ સંપતી નું વર્ણન

તમામ ભાગ અને ઠિસ્સો સ્થાવર રહેણાંક મિલકત નો આર.એસ. નં. ૪૨૧ પૈકી, ફલ ક્ષેત્રફળ ૧૩૧૨ ચોરસ મીટર, જે 'જગન્નાથ ફ્લેટ' તરીકે ઓળખાય છે પૈકી પહેલો માળ, ફલેટ નં. ૧૧૨ બિલ્ટઅપ બાંધકામ ક્ષેત્રફળ ૪७.૫૮ ચોરસ મીટર અવિભાજીત જમીન ના હિસ્સાનં ક્ષેત્રફળ ૨૯.૪૧ ચોરસ મીટર મોજે દંતેશ્વર નો રજીસ્ટ્રેશન જીલ્લો અને સબ–જીલ્લો વડોદરા જે શ્રીમતી ગીતાબેન સંતરામ બનીયા અને શ્રી સંતરામ રામદેવ બનીયા અને ચતુર્સીમાઃ પૂર્વઃ ફલેટ નં. ૧૧૧, પશ્ચિમઃ માર્જીન સ્પેસ, ઉત્તરઃ માર્જીન સ્પેસ, દક્ષિણઃ ફલેટ નં. ૧૦૧.

તા.: ૨૪.૦૮.૨૦૨૫ નોંધઃ વિવાદની સ્થિતિમાં આ નોટીસનો

અધિકૃત અધિકારી

રેપીક૮ કાર્બાઇક્સ લિમિટેક

૧૧૯, જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, અંકલેશ્વર ૩૯૩૦૦૨, ગુજરાત sia : 0403055015/ 0555005503

CIN: L28910GJ1977PLC002998

■ શેરધારકો ને જાણવા જોગ નોટીસ■ વિષય : "સક્ષમ નિવેશક" ઝુંબેશ ની શરૂઆત - દાવો ન કરાયેલ ડિવિડન્ડ અને કેવાયસી અપડેટસ માટે જરૂરી કાર્ચવા**હી**.

રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા સત્તામંડળ (IEPFA), કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) ના ૧૬ મી જુલાઇ ૨૦૨૫ ના પત્ર અનુસાર, રેપીકટ કાર્બાઇક્સ્ લિમિટેક તમને ૨૮ મી જુલાઇ, ૨૦૨૫ થી ૬ નવેમ્બર, ૨૦૨૫ સુધી "સક્ષમ નિવેશક" નામની ૧૦૦ દિવસીય વિશેષ આઉટરીચ પહેલની શરૂઆત વિશે જણાવતા આનંદ અનુભવે છે.

આ ઝુંબેશ શેરઘારકોને તમારા ગ્રાહકની જાણો (KYC) વિગતો અપડેટ કરવામાં સુવિધા આપવા માટે હાથ ધરવામાં આવી રહી છે. જેમા સામેલ છે :

- लेन्ड ओडाઉन्ट भेन्डेट
- નોમીની નોંઘણી
- સંપર્ક માહિતી (ઇમેઇલ, મોબાઇલ નંબર, સરનામું) આ ઝુંબેશ શેરધારકોને કોઇપણ નાણાંકીય વર્ષ માટે તેમના નહી ચુકવાયેલા/દાવો

ન કરાંચેલા કિવિકન્ક નો દાવો કરવાની સુવિધા આપવા માટે પણ હાથ ધરવામાં આવી રહી છે. જેથી તેમના ડિવિડન્ડ ની રકમ અને શેર રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા સત્તામંડળ (IEPFA) માં ટ્રાન્સફર થતાં અટકાવી શકાય. જરૂરી કાર્ચવાહી :

શેરધારકોએ તેમના ડિવિડન્ડનો દાવો કાર્યો નથી અથવા અઘરા (KYC) રેકોર્ડ ઘરાવતા હોય તેમને કંપનીના રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ (RTA) MUFG Intime India Private Limited, C-101, Embassy 247, L.B.S. Marg, Vikhroli (West), Mumbai

- 4 0 0 0 8 3 P h o n e : 8 1 0 8 1 1 6 7 6 7 https://web.in.mpms.mufg.com/helpdesk/Service_Request.html. ਗੇ ਪਣੇਰੀ ਰਤੇ સંપર્ક કરવા વિનંતી છે. વધુમાં શેરધારકોને SWAYAM પોર્ટલ https://swayam.in.mpms.mufg.com દ્વારા

નોંઘણી કરાવવા અને તેમની વિનંતીઓને ટ્રેક કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે મહત્વપર્ણ સલાદ :

જ્યા કરીને નોંધી લો કે કંપની લાગુ જોગવાઇઓ મુજબ, જો કિયિકન્ડ સતત સાત વર્ષ સુધી દાવો ન કરાચેલ રહે, તો કિયિકન્ડની રકમ અને અનુરૂપ બેઝ શેર (જો ઉપલબ્ધ હોચ તો) રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા સત્તામંડળ (IEPFA) ને ટ્રાન્સફર કરવા માટે જવાબદાર છે.

અમે બધા શેરધારકોને પિનંતી કરીએ છીએ કે, તેઓ ઝુંબેશના સમયગાળા દરમ્યાન તેમના દકકોનું રસણા કરવા અને કાયદાકીય રેપીકટ કાર્બાઇક્સ (લિમેટેક વતી આવશ્ચકતાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલા લે. સ્થળ : અંકલેશ્વર (તેનેજીંગ ડાયરેક્ટર)

તારીખ : ૨૬/૦૮/૨૦૨૫

(DIN: 07570948)

🎉 बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

બેંક ઓફ બરોડા-નોવિનો તરસાલી શાખા દ્વારકેશ બિલ્કીંગ, રામબાગ સોસાયટી સામે, મકરપુરા મેઈન રોડ. વહોદરા-૩૯૦૦૧૦. મોઃ ૬૩૫૯૦૦૧૫७૬. પરિશિષ્ટ – IV - [રૂલ ૮ (૧)] **કબજા અંગેની નોટિસ** (સ્થાવર મિલ્કત માટે)

નીચે સહી કરનાર સીક્યુરીટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાસનાન્સીયલ એસેટ્સ એન્ એન્ફોર્સમેન્ટ ઓફ સીક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ ના ૫૪) નો હેઠળ તે કલગ્ ૧૩(૧૨) ના નિયમ ૩ ની સાથે વાંચતા સીક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ મળેલ અધિકારો હેઠળ **બેંક ઓફ બરોડા,** ના અધિકૃત અધિકારીની રૂઇએ નીચે જણાવેલ બાકી કરજદાર **શ્રી ધનરાજકુમાર જયદીપસિંહ પરમાર**ેને **ડીમાન્ડ નોટીસ તા.30.0૧.૨૦૨૫** ના પાઠવીને નોટીસ માં બાકી ખાતેદાર સામે દર્શાવેલી **હાઉસીંગ લોન** બાકી રક્રમ રૂા.૧૦,૩૪,૩૪૧.૫૭ (પ્રિન્સીપાલ-રૂા. ૧૦,૩૨,૭૮૧.૦૦ + અન અપ્લાચક વ્યાજ રક૦૨.૫૭) અને ટોપ-અપ લોન રૂા. ૨૦,૯૫,૧૯૨.૧૪ (પ્રિન્સીપાલ-રૂા. ૨૦,૮૯,૯૨૫.૦૦ + અન અપ્લાચક વ્યાજ ૫૭૫૦.૧૪) કુલ બાકી રૂપિયા ૩૧,૨૯,૫૫૩.૭૧ (રૂપિયા એકત્રીસ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો ત્રેપ્પન અને પૈસા **ઇકોત્તેર પુરા**) ૨૪.૦૧.૨૦૨૫ થી તેના પરનું વ્યાજ ઉપરોક્ત સૂચના મળ્યાની તારીખથી ક્લ દિવસની અંદર.

બાકી કરજદાર/જામીનદાર/મોર્ટગેજર નીચે જણાવેલી રકમોની પરત ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, આ સાથે બાકી કરજદાર અને નાગરિકને જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે અત્રે આવેલા નીચેં દર્શાવેલી મિલકતનું ઉપર જણાવેલ નીયમોના સીક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ ના નિયમ ૮ ને સબંધીત ની કલમ ૧૩ ની સબ કલમ (૪) ની સાથે વટહુકમ એક્ટ વાંચતા તેને પ્રાપ્ત થતી સત્તાઓ અનુસાર મિલકતનો **કબજો તા** ર3.0૮.૨0૨૫ ના રોજ લીધો છે.

બાકી કરજદાર અને સામાન્ય સંદર્ભમાં નાગરીકોને અત્રે નીચે જણાવેલી અનુસુચિત મિલકતન બાબતમાં કોઇપણ પ્રકારનો વ્યવહાર કે લેવડ દેવડ ન કરવા ચેતવણી આપવામાં આવે છે, **બેં**ક **ઓફ બરોડા, નોવિનો શાખા, વડોદરા** ની બાકી લેણા રકમ **હાઉસીંગ લોન** બાકી રકમ રૂા.૧૦,૩૪,૩૪૧.૫७ (પ્રિન્સીપાલ-રૂા. ૧૦,૩૨,૭૮૧.૦૦ + અન અપ્લાચક વ્યા૧ २५०२.५७) अने टोप-अप लोन ३ा. २०,६५,१६२.१४ (प्रिन्सीपाल-३। ૨૦,૮૯,૯૨૫.૦૦ + અન અપ્લાયક વ્યાજ પહપ૦.૧૪) કુલ બાકી રૂપિયા ૩૧,૨૯,૫૫૩.૭૧ (રૂપિયા એકત્રીસ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો ત્રેપ્પન અને પૈસા **ઇકોત્તેર પુરા**) રકમ અને તેના પરના વ્યાજ માટે.

કરજદાર ને ધ્યાન દોરવામાં આવે છે કે પોતાની મિલકત સેક્શન ૧૩ ના એક્ટ હેઠળ સબ સેક્શન (૮) મુજબ મિલકત મેળવવા રકમ ભરવા સમચની જોગવાઇ કરવામાં આવી છે.

આ મિલકત રત્ના કુંજ હાઇટ્સ તરીકે ઓળખાતી પ્રોજેક્ટ માં છે જમીન પરના બાંઘકામ નો રેવન્ચ સર્વે નં. ૪/૧/૧ ક્ષેત્રકળ ૨૨૨૬ ચોરસ મીટર પૈકી ૯ મીટર રસ્તો બાદ કર્યા પછી બાકી રહેલો ૧७७૦ ચોરસ મીટર (૧૯૦૫૨ ચોરસ ફટ) સ્ક્રીમ 'અમૃત' ટાવર પાંચ મો માળ, ફલેટ નં ૫૦૧ બાંધકામ ક્ષેત્રફળ ૫૨.૦૫૫ ચોરસ મીટર કોમન પેસેજ, દાદર, પાર્કિંગ, લિફટ, કેબીન ક્ષેત્રફળ ૪૧.७७૫ ચોરસ મીટર કુલ ક્ષેત્રફળ ૯૩.૮૩ ચોરસ મીટર ઓપન ટેરેસ ક્ષેત્રફળ ૬૯.૬७ ચોરસ મીટર ઓપન ટેરેસ ક્ષેત્રફળ ૬૯.૬७ ચોરસ મીટર અવિભાજીત જમીન ક્ષેત્રફળ ૨૩ ચોરસ મીટર મોજે બાપોદ રજીસ્ટ્રેશન જીલ્લો અને સબ જીલ્લો વડોદરા. ચતુર્સીમાઃ પૂર્વઃ ફલેટ નં. ૫૦૨, પશ્ચિમઃ અમૃત ટાવર માર્જીન, ઉત્તરઃઅમૃત ટાવર માર્જીન, દક્ષિણઃ ૧૮ મીટર રોડ

તા.: ૨૩.૦૮.૨૦૨૫ નોંધ: વિવાદની સ્થિતિમાં આ નોટીસનો સ્થળ: વડોદરા અંગ્રેજ અનુવાદ માન્ય ગાગો

અધિકૃત અધિકારી









વૈકલ્પિક એસએન સુવિધાની વ્યવસ્થા (ફરીથી આમંત્રણ)



